

RAN-2408000604050009**S.Y.B.Com. (Sem.-IV) Examination April - 2026****SEC-Goods And Services Tax (Paper-II)****[Total Marks: 25**

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book	Seat No.: Student's Signature
---	--

- પ્ર.1. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત ઉત્તરો આપો. (કોઈ પણ પાંચ) 10**
1. ફરજિયાત નોંધણી અને સ્વૈચ્છિક નોંધણીનો અર્થ શું છે?
 2. GST હેઠળ નોંધણી માટે કોણ જવાબદાર છે?
 3. GST હેઠળ વિવિધ પ્રકારના રિટર્નના નામ લખો.
 4. ઇલેક્ટ્રોનિક જવાબદારી લેજર શબ્દ સમજાવો.
 5. નિયમિત રિટર્નનો અર્થ શું છે?
 6. આઉટવર્ડ સપ્લાય અને ઇનવર્ડ સપ્લાયનો અર્થ શું છે?
 7. ક્રેડિટના વિનિયોગ અને બ્લોકડ ક્રેડિટ વચ્ચે તફાવત કરો.
- પ્ર.2. અ. ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઉપયોગ માટેની પ્રક્રિયાની ચર્ચા કરો. 08**
- બ. GST પ્રેક્ટિશનર- વિગતવાર ચર્ચા કરો. 07**
- અથવા**
- પ્ર.2. અ. GST હેઠળ નોંધણી રદ કરવા અને નોંધણી રદ કરવાનું રદબાતલ કરવા માટેની પ્રક્રિયા. 08**
- બ. ઇલેક્ટ્રોનિક જમા ખાતાવહી અને ઇલેક્ટ્રોનિક ઉધાર ખાતાવહી વિગતવાર સમજાવો. 07**

ENGLISH VERSION

- Q.1. Answer the following questions in brief. (Any Five) 10**
1. What do you mean by compulsory registration and voluntary registration?
 2. Who is liable for registration under GST?
 3. Write name of various types of returns under GST.
 4. Explain the term Electronic Liability Ledger.
 5. What do you mean by Regular Return?
 6. What do you mean by Outward Supply and Inward Supply?
 7. Differentiate between Appropriation of credit & Blocked credits.
- Q.2. A. Discuss the procedure for utilization of Input Tax Credit. 08**
- B. Discuss in details - GST practitioner. 07**
- OR**
- Q.2. A. Procedure for cancellation & Revocation for cancellation of Registration under GST. 08**
- B. Electronic Credit Ledger and Electronic Debit Ledger - explain in detail. 07**